



सत्यमेव जयते

The Gujarat Government Gazette

SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION

PUBLISHED BY AUTHORITY

VOL. LXIV] TUESDAY, 10th OCTOBER, 2023/ASHVINA 18, 1945 [No. 130

Separate paging is given to each part of the supplement to the Central Gazette and Central section in order that it may be filed as a separate compilation

PART-II

EXTRAORDINARY

સુરત મહાનગરપાલિકા

નગર રચના યોજના, સુરત નં. ૨૪(મોટાવરાછા-ઉત્રાણ) (પ્રથમ ફેરફાર)નો મુસદ્દો પ્રસિધ્ધ કરવા બાબત

અધિસૂચન

નં. ટીપીડી/આ/૨૮૬૯.—આથી જાહેર કરવામાં આવે છે કે, મુસદ્દારૂપ નગર રચના યોજના, સુરત નં.૨૪(મોટાવરાછા-ઉત્રાણ)(પ્રથમ ફેરફાર)નો મુસદ્દો, ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ ની કલમ-૪૨(૧) અને અધિનિયમના નિયમો-૧૯૭૯ ના નિયમ-૧૮ હેઠળ (યોજનાના મુસદ્દાની દરખાસ્ત) તૈયાર કરેલ છે. જેને આથી પ્રસિધ્ધ કરવામાં આવે છે.

ફાયનલ ટી.પી. સ્કીમ નં.૨૪(મોટાવરાછા-ઉત્રાણ), મોજે : મોટાવરાછા, બ્લોક નં.૨૭૩, ફા.પ્લોટ નં.૧૩૦ પૈકીની તથા એપ્રોપ્રિએટ ઓથોરીટી-સુરત મહાનગરપાલિકાને સેલેબલ ફોર કોમર્શીયલના જાહેર હેતુ માટે ફાળવેલ અનામત અંતિમખંડ નં. આર-૭ (૧૫૮) (સેલેબલ ફોર કોમર્શીયલ) પૈકીની જગ્યાઓના પરસ્પર સ્થાનફેર, આયોજન/પુનઃરચનામાં ફેરફાર કરવા વેરીએશન કરવાની જરૂરીયાત હોય, ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ની જોગવાઈઓ હેઠળ વેરીએશન કરવા અંગે ઉક્ત જણાવેલ યોજનાના મુસદ્દાની એક નકલ જમીન માલિકો તેમજ હિતસંબંધ ધરાવનાર વ્યક્તિઓ તથા જાહેર જનતાને જોવા માટે ટાઉન પ્લાનરશ્રી કચેરી, ટાઉન પ્લાનીંગ વિભાગ, સુરત મહાનગરપાલિકા, બહુમાળી બિલ્ડીંગની પાછળ, નાનપુરા, સુરતના નોટીસ બોર્ડ પર રજાના દિવસો સિવાય ઓફિસ સમય દરમ્યાન ખુલ્લી રાખવામાં આવેલ છે.

સરકારી રાજ્યપત્રમાં ઉપરોક્ત અધિસૂચન પ્રસિધ્ધ થયાની તારીખથી એક મહીનાની અંદર આ યોજનાથી અસર પામતી કોઈપણ વ્યક્તિ આ યોજના સંબંધમાં વાંધા/સૂચનો બે નકલોમાં લેખિતમાં કમિશ્નરશ્રી, સુરત મહાનગરપાલિકાને સુપ્રત કરશે તો, આવા વાંધાઓ ધ્યાને લેવામાં આવશે.

સુરત.
તા. ૦૯-૧૦-૨૦૨૩

સહી/- અવાચ્ય
કમિશનર
સુરત મહાનગરપાલિકા

સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિના તા. ૦૯-૧૦-૨૦૨૩ ના રોજ
મળેલ સભામાં નીચે મુજબનો ઠરાવ પસાર થયો હતો :

મ્યુ. કમિશ્નરશ્રીના તા. ૨-૮-૨૦૨૩ ના પત્ર નં.સીમીસ/૮/૫ થી વિદિત થઈ, મુસદ્દારૂપ નગર રચના યોજના નં. ૨૪(મોટાવરાછા-ઉત્રાણ) (પ્રથમ ફેરફાર) નો ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ, ૧૯૭૬ ની કલમ-૪૨(૧) હેઠળ મુસદ્દો પ્રસિધ્ધ કરવાની કાર્યવાહી કરવાનું તથા દરખાસ્ત સાથે સામેલ અધિસુચન મંજૂર કરવાનું તથા તેને આનુસંગિક જરૂરી તમામ કાર્યવાહી કરવાનું તથા આ માટે તમામ જરૂરી કાર્યવાહી/પત્ર વ્યવહાર કરવા મ્યુ. કમિશ્નરશ્રીને અધિકૃત કરવાનું ઠરાવવામાં આવે છે.

ઠરાવ નં. ૧૮/૨૦૨૩ મંજૂર

સુરત મહાનગરપાલિકા

અંતિમ નગર રચના યોજના નં. ૨૪(મોટાવરાછા-ઉત્રાણ) માં વેરીએશન કરવા બાબત (થર્ડ વેરીડ)

અધિસુચન

નં. ટીપીડી/આ/૨૮૭૦.—ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ની કલમ-૭૧ હેઠળ વેરીએશન કરવા અંગે કલમ-૪૧ની જોગવાઈઓ હેઠળ સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિના ઠરાવ નં.૨૦/૨૦૨૩, તા. ૦૯-૧૦-૨૦૨૩ થી,

મુખ્ય નગર નિયોજકશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા. ૧૪-૦૭-૨૦૨૩ ના પત્ર નં.સુરત/નરયો નં.૨૪ (ઉત્રાણ-મોટાવરાછા)/વેરીએશન/ત્રી.ફે/૨૩૫૧ થી સુચિત નગર રચના યોજના નં.૨૪(મોટાવરાછા-ઉત્રાણ) (થર્ડ વેરીડ) ની દરખાસ્તને અધિનિયમની કલમ-૪૧(૧) હેઠળ આપેલ અનુમોદન અન્વયે અંતિમ નગર રચના યોજના નં. ૨૪(મોટાવરાછા-ઉત્રાણ) માં ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ -૧૯૭૬ની કલમ- ૭૧ હેઠળ વેરીએશન કરવા અંગે નકશામાં ઘેરા ગુલાબી(મજન્ટા) રંગની તુટક રેખાથી દર્શાવેલ હદ મુજબ વેરીએશન કરવા ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ની કલમ-૪૧(૨) હેઠળ ઈરાદો જાહેર કરવામાં આવેલ છે. જે મુજબના નકશાની એક નકલ જમીન માલિકો, હિતસંબંધ ધરાવનાર વ્યક્તિઓ તથા જાહેર જનતાને જોવા માટે ટાઉન પ્લાનરશ્રીની કચેરી, ટાઉન પ્લાનીંગ વિભાગ, સુરત મહાનગરપાલિકા, બહુમાળી બિલ્ડીંગની પાછળ, નાનપુરા, સુરત ખાતે રજાના દિવસો સિવાયના દિવસે ઓફિસ સમયમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે.

સુરત.

તા. ૦૯-૧૦-૨૦૨૩

સહી/- અવાચ્ય

કમિશનર

સુરત મહાનગરપાલિકા

સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિની તા. ૯-૧૦-૨૦૨૩ ના રોજ

મળેલ સભામાં નીચે મુજબનો ઠરાવ પસાર થયો હતો:-

મ્યુ. કમિશ્નરશ્રીના તા.૮-૮-૨૦૨૩ ના પત્ર નં. સીમીસ/૮/૭ થી વિદિત થઈ, મુખ્ય નગર નિયોજકશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા. ૧૪-૦૭-૨૦૨૩ ના પત્ર નં.સુરત/નરયો નં.૨૪ (ઉત્રાણ-મોટાવરાછા)/વેરીએશન/ત્રી.ફે/૨૩૫૧ થી પાઠવેલ અનુમોદન અન્વયે અંતિમ નગર રચના યોજના નં. ૨૪(મોટાવરાછા-ઉત્રાણ) માં ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ ની કલમ-૭૧ હેઠળ વેરીએશન કરવા અંગે ઈરાદો જાહેર કરવા અંગે ફાઈલના પત્રવ્યવહાર વિભાગ સાથે સામેલ નકશામાં ઘેરા ગુલાબી (મજન્ટા) રંગની તુટક રેખાથી દર્શાવેલ હદ મુજબ વેરીએશન કરવા ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ ની કલમ-૪૧(૨) હેઠળ સુચિત નગર રચના યોજના નં. ૨૪(મોટાવરાછા-ઉત્રાણ) (થર્ડ વેરીડ) તૈયાર કરવા અંગે ઈરાદો જાહેર કરવાનું, સદર ઈરાદો જાહેર કરવા અંગે સામેલ અધિસુચન મંજૂર કરવાનું, સદર અધિસુચનને બહોળો ફેલાવો ધરાવતા બે સ્થાનિક દૈનિક વર્તમાનપત્રોમાં એક-એક વખત પ્રસિધ્ધ કરવાનું, ઈરાદો જાહેર કર્યા મુજબ સરકારશ્રીના રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરવાનું તેમજ મુસદ્દો તૈયાર કરી સરકારશ્રીમાં સાદર કરવાની તમામ આનુસંગિક કાર્યવાહી માટે મ્યુ. કમિશ્નરશ્રીને અધિકૃત કરવાનું ઠરાવવામાં આવે છે.

ઠરાવ નં.૨૦/૨૦૨૩ સર્વાનુમતે મંજૂર

સુરત મહાનગરપાલિકા

નગર રચના યોજના, સુરત નં. ૧૬ (કપાદ્રા) (બીજો ફેરફાર)નો મુસદ્દો પ્રસિધ્ધ કરવા બાબત

અધિસૂચન

નં. ટીપીડી/આ/૨૮૭૧.—આથી જાહેર કરવામાં આવે છે કે, મુસદ્દારૂપ નગર રચના યોજના, સુરત નં. ૧૬ (કપાદ્રા)(બીજો ફેરફાર)નો મુસદ્દો, ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ ની કલમ-૪૨(૧) અને અધિનિયમના નિયમો-૧૯૭૮ના નિયમ-૧૮ હેઠળ (યોજનાના મુસદ્દાની દરખાસ્ત) તૈયાર કરેલ છે. જેને આથી પ્રસિધ્ધ કરવામાં આવે છે.

અંતિમ નગર રચના યોજના સુરત નં. ૧૬(કપાદ્રા)માં મુળખંડ નં. ૪૯+૫૧ ને ફાળવેલ અંતિમખંડ નં.૩૮ પૈકીની તથા સુરત મહાનગરપાલિકાને “પબ્લીક હાઉસીંગ”ના હેતુ માટે ફાળવેલ અનામત અંતિમખંડ નં. ૪૫ પૈકીની જગ્યાઓને આયોજનમાં ફેરફાર / પુનઃરચના કરવા માટે વેરીએશન કરવાની જરૂરીયાત હોય, ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ ૧૯૭૬ની જોગવાઈઓ હેઠળ વેરીએશન કરવા અંગે ઉક્ત જણાવેલ યોજનાના મુસદ્દાની એક નકલ જમીન માલિકો તેમજ હિતસંબંધ ધરાવનાર વ્યક્તિઓ તથા જાહેર જનતાને જોવા માટે ટાઉન પ્લાનરશ્રીની કચેરી, ટાઉન પ્લાનીંગ વિભાગ, સુરત મહાનગરપાલિકા, બહુમાળી બિલ્ડીંગની પાછળ, નાનપુરા, સુરતના નોટીસ બોર્ડ પર રજાના દિવસો સિવાય ઓફિસ સમય દરમ્યાન ખુલ્લી રાખવામાં આવેલ છે.

સરકારી રાજ્યપત્રમાં ઉપરોક્ત અધિસૂચન પ્રસિધ્ધ થયાની તારીખથી એક મહીનાની અંદર આ યોજનાથી અસર પામતી કોઈપણ વ્યક્તિ આ યોજના સંબંધમાં વાંધા/સુચનો બે નકલોમાં લેખિતમાં કમિશ્નરશ્રી, સુરત મહાનગરપાલિકાને સુપ્રત કરશે તો, આવા વાંધાઓ ધ્યાને લેવામાં આવશે.

સુરત.

તા. ૦૯-૧૦-૨૦૨૩

સહી/- અવાચ્ય

કમિશનર

સુરત મહાનગરપાલિકા

સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિના તા. ૯-૧૦-૨૦૨૩ ના રોજ

મળેલ સભામાં નીચે મુજબનો ઠરાવ પસાર થયો હતો

મ્યુ.કમિશ્નરશ્રીના તા. ૨૩-૦૮-૨૦૨૩ના પત્ર નં.સીમીસ/૮/૮ થી વિદિત થઈ, ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.૧૬ (કપાદ્રા)(બીજો ફેરફાર)નો ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ ની કલમ-૪૨(૧) હેઠળ મુસદ્દો પ્રસિધ્ધ કરવાની કાર્યવાહી કરવાનું તથા દરખાસ્ત સાથે સામેલ અધિસૂચન મંજૂર કરવાનું તથા તેને આનુસંગિક જરૂરી તમામ કાર્યવાહી કરવાનું તથા આ માટે તમામ જરૂરી કાર્યવાહી/પત્ર વ્યવહાર કરવા મ્યુનિ. કમિશ્નરશ્રીને અધિકૃત કરવાનું ઠરાવવામાં આવે છે.

ઠરાવ નં. ૨૧/૨૦૨૩ સર્વાનુમતે મંજૂર

સુરત મહાનગરપાલિકા

નગર રચના યોજના, સુરત નં. ૮૮ (વરીયાવ) નો મુસદ્દો પ્રસિધ્ધ કરવા બાબત

અધિસૂચન

નં. ટીપીડી/૨૮૭૨.—આથી જાહેર કરવામાં આવે છે કે ઉપરોક્ત (મુસદ્દારૂપ યોજના) યોજનાનો મુસદ્દો ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ -૧૯૭૬ ની કલમ-૪૨(૧) અને અધિનિયમનાં નિયમો-૧૯૭૮ ના નિયમ-૧૮ અન્વયે તૈયાર કરી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ યોજનાની મુખ્ય હદો નીચે મુજબ છે.

ઉત્તરે : મોજે : કનાદ તથા મોજે : વરીયાવ પૈકીનો વિસ્તાર

દક્ષિણે : ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.૩૮(વરીયાવ) તથા તાપી નદી

પૂર્વે : ફાયનલ ટી.પી.સ્કીમ નં. ૩૮(વરીયાવ) તેમજ મોજે : વરીયાવ પૈકીનો વિસ્તાર

પશ્ચિમે : ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.૩૮(વરીયાવ) તથા મોજે : સરોલી પૈકીનો વિસ્તાર

ઉપર જણાવેલ યોજનાના મુસદ્દાની એક નકલ જમીન માલિકો તેમજ હિતસંબંધ ધરાવનાર વ્યક્તિઓ તથા જાહેર જનતાને જોવા માટે ટાઉન પ્લાનરની કચેરી, ટાઉન પ્લાનીંગ વિભાગ, સુરત મહાનગરપાલિકા, બહુમાળી બિલ્ડીંગની પાછળ, નાનપુરા, સુરતની કચેરીમાં રજાના દિવસો સિવાય ઓફિસ સમય દરમ્યાન ખુલ્લી રાખવામાં આવેલ છે.

સરકારી રાજ્યપત્રમાં ઉપરોક્ત અધિસૂચનની પ્રસિધ્ધ થયાની તારીખથી એક મહીનાની અંદર આ યોજનાથી અસર પામતી કોઈપણ વ્યક્તિ આ યોજનાના સંબંધમાં વાંધા/સુચનો બે નકલોમાં લેખિતમાં કમિશ્નરશ્રી, સુરત મહાનગરપાલિકાને સુપ્રત કરશે તો, કમિશ્નરશ્રી, સુરત મહાનગરપાલિકા આવા વાંધાઓ યોગ્ય જણાયે ધ્યાને લેશે.

સુરત.

તા. ૦૯-૧૦-૨૦૨૩

સહી/- અવાચ્ય

કમિશ્નર

સુરત મહાનગરપાલિકા

સુરત મહાનગરપાલિકા

નગર રચના યોજના, સુરત નં. ૮૬ (કોસાડ) નો મુસદ્દો પ્રસિધ્ધ કરવા બાબત

અધિસૂચન

નં. ટીપીડી/આ/૨૮૭૩.—આથી જાહેર કરવામાં આવે છે કે, ઉપરોક્ત (મુસદ્દારૂપ યોજના) યોજનાનો મુસદ્દો ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૪૨(૧) અને અધિનિયમનાં નિયમો-૧૯૭૯ નાં નિયમ-૧૮ અન્વયે તૈયાર કરી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ યોજનાની મુખ્ય હદો નીચે મુજબ છે.

ઉત્તરે : ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં. ૮૪ (મોટા વરાછા-અબ્રામા-ભરથાણા કોસાડ-કોસાડ)

દક્ષિણે : ગુજરાત સ્ટેટ એનર્જી કોર્પોરેશન રેલ્વે લાઈન વાળી જગ્યા.

પૂર્વે : ફાયનલ ટી.પી. સ્કીમ નં.૨૪(મોટા વરાછા-ઉત્રાણ), ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં. ૨૫(મોટા વરાછા), મોજે : મોટા વરાછા ગામ.

પશ્ચિમે : સુરત-અમદાવાદ રેલ્વે લાઈન.

ઉપર જણાવેલ યોજનાના મુસદ્દાની એક નકલ જમીન માલિકો તેમજ હિતસંબંધ ધરાવનાર વ્યક્તિઓ તથા જાહેર જનતાને જોવા માટે ટાઉન પ્લાનરની કચેરી, ટાઉન પ્લાનીંગ વિભાગ, સુરત મહાનગરપાલિકા, બહુમાળી બિલ્ડીંગની પાછળ, નાનપુરા, સુરતની કચેરીમાં રજાના દિવસો સિવાય ઓફિસ સમય દરમ્યાન ખુલ્લી રાખવામાં આવેલ છે.

સરકારી રાજ્યપત્રમાં ઉપરોક્ત અધિસૂચનની પ્રસિધ્ધ થયાની તારીખથી એક મહીનાની અંદર આ યોજનાથી અસર પામતી કોઈપણ વ્યક્તિ આ યોજનાના સંબંધમાં વાંધા / સુચનો બે નકલોમાં લેખિતમાં કમિશ્નરશ્રી, સુરત મહાનગરપાલિકાને સુપ્રત કરશે તો, કમિશ્નરશ્રી, સુરત મહાનગરપાલિકા આવા વાંધાઓ યોગ્ય જણાયે ધ્યાને લેશે.

સુરત.

તા. ૦૯-૧૦-૨૦૨૩

સહી/- અવાચ્ય

કમિશ્નર

સુરત મહાનગરપાલિકા

સુરત મહાનગરપાલિકા

નગર રચના યોજના, સુરત નં. ૯૧ (વેસુ) નો મુસદ્દો પ્રસિધ્ધ કરવા બાબત

અધિસૂચન

નં. ટીપીડી/આ/૨૮૭૪.—આથી જાહેર કરવામાં આવે છે કે, ઉપરોક્ત (મુસદ્દારૂપ યોજના) યોજનાનો મુસદ્દો ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૪૨(૧) અને અધિનિયમનાં નિયમો-૧૯૭૯ નાં નિયમ-૧૮ અન્વયે તૈયાર કરી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ યોજનાની મુખ્ય હદો નીચે મુજબ છે.

ઉત્તરે : ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં. ૫(વેસુ-ભીમરાડ)

દક્ષિણે : સુચિત ટી.પી.સ્કીમ નં. ૯૦(સરસાણા)

પૂર્વે : ફાયનલ ટી.પી.સ્કીમ નં. ૪૨(ભીમરાડ)ની હદ

પશ્ચિમે : ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.૭૫(વેસુ-મગદલ્લા-ગવીયર-આભવા), ફાયનલ ટી.પી.સ્કીમ નં. ૦૨ (વેસુ- ભરથાણા-વેસુ)

ઉપર જણાવેલ યોજનાના મુસદ્દાની એક નકલ જમીન માલિકો તેમજ હિતસંબંધ ધરાવનાર વ્યક્તિઓ તથા જાહેર જનતાને જોવા માટે ટાઉન પ્લાનરની કચેરી, ટાઉન પ્લાનીંગ વિભાગ, સુરત મહાનગરપાલિકા, બહુમાળી બિલ્ડીંગની પાછળ, નાનપુરા, સુરતની કચેરીમાં રજાના દિવસો સિવાય ઓફિસ સમય દરમ્યાન ખુલ્લી રાખવામાં આવેલ છે.

સરકારી રાજ્યપત્રમાં ઉપરોક્ત અધિસૂચનની પ્રસિધ્ધ થયાની તારીખથી એક મહીનાની અંદર આ યોજનાથી અસર પામતી કોઈપણ વ્યક્તિ આ યોજનાના સંબંધમાં વાંધા / સુચનો બે નકલોમાં લેખિતમાં કમિશ્નરશ્રી, સુરત મહાનગરપાલિકાને સુપ્રત કરશે તો, કમિશ્નરશ્રી, સુરત મહાનગરપાલિકા આવા વાંધાઓ યોગ્ય જણાયે ધ્યાને લેશે.

સુરત.

તા. ૦૯-૧૦-૨૦૨૩

સહી/- અવાચ્ય

કમિશનર

સુરત મહાનગરપાલિકા

સુરત મહાનગરપાલિકા

નગર રચના યોજના, સુરત નં. ૯૦ (સરસાણા) નો મુસદ્દો પ્રસિધ્ધ કરવા બાબત

અધિસૂચન

નં. ટીપીડી/આ/૨૮૭૫.—આથી જાહેર કરવામાં આવે છે કે, ઉપરોક્ત (મુસદ્દારૂપ યોજના) યોજનાનો મુસદ્દો ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૪૨(૧) અને અધિનિયમનાં નિયમો-૧૯૭૯ નાં નિયમ-૧૮ અન્વયે તૈયાર કરી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ યોજનાની મુખ્ય હદો નીચે મુજબ છે.

ઉત્તરે : સુચિત ટી.પી.સ્કીમ નં. ૯૧(વેસુ) તથા ફાયનલ ટી.પી.સ્કીમ નં. ૪૨(ભીમરાડ)

દક્ષિણે : મોજે ખજોદ પૈકીનો વિસ્તાર

પૂર્વે : ફાયનલ ટી.પી.સ્કીમ નં. ૪૨(ભીમરાડ) તથા મોજે સરસાણાનો વિસ્તાર

પશ્ચિમે : ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં. ૨૬(આભવા)

ઉપર જણાવેલ યોજનાના મુસદ્દાની એક નકલ જમીન માલિકો તેમજ હિતસંબંધ ધરાવનાર વ્યક્તિઓ તથા જાહેર જનતાને જોવા માટે ટાઉન પ્લાનરની કચેરી, ટાઉન પ્લાનીંગ વિભાગ, સુરત મહાનગરપાલિકા, બહુમાળી બિલ્ડીંગની પાછળ, નાનપુરા, સુરતની કચેરીમાં રજાના દિવસો સિવાય ઓફિસ સમય દરમ્યાન ખુલ્લી રાખવામાં આવેલ છે.

સરકારી રાજ્યપત્રમાં ઉપરોક્ત અધિસૂચનની પ્રસિધ્ધ થયાની તારીખથી એક મહીનાની અંદર આ યોજનાથી અસર પામતી કોઈપણ વ્યક્તિ આ યોજનાના સંબંધમાં વાંધા/સુચનો બે નકલોમાં લેખિતમાં કમિશ્નરશ્રી, સુરત મહાનગરપાલિકાને સુપ્રત કરશે તો, કમિશ્નરશ્રી, સુરત મહાનગરપાલિકા આવા વાંધાઓ યોગ્ય જણાયે ધ્યાને લેશે.

સુરત.

તા. ૦૯-૧૦-૨૦૨૩

સહી/- અવાચ્ય

કમિશનર

સુરત મહાનગરપાલિકા

સુરત મહાનગરપાલિકા

નગર રચના યોજના, સુરત નં. ૮૭ (ગભેણી) નો મુસદ્દો પ્રસિધ્ધ કરવા બાબત

અધિસૂચન

નં. ટીપીડી/આ/૨૮૭૬.—આથી જાહેર કરવામાં આવે છે કે, ઉપરોક્ત (મુસદ્દારૂપ યોજના) યોજનાનો મુસદ્દો ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૪૨(૧) અને અધિનિયમનાં નિયમો-૧૯૭૯ નાં નિયમ-૧૮ અન્વયે તૈયાર કરી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ યોજનાની મુખ્ય હદો નીચે મુજબ છે.

ઉત્તરે : ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં. ૬૭(જીઆવ-સોનારી ગભેણી), મોજે : જીઆવ પૈકી, મોજે : સોનારી, પૈકી મોજે : ગભેણી પૈકી, તથા મોજે : બુડિયા પૈકીનો વિસ્તાર

દક્ષિણે : ગભેણી ગામતળ તથા મોજે : ગભેણી પૈકીનો બાકીનો વિસ્તાર

પૂર્વે : સચિન જી.આઈ.ડી.સી. તથા સચિન નોટીફાઈડ અરિયાનો વિસ્તાર

પશ્ચિમે : ખાડી અને મોજે : ગભેણી પૈકીનો બાકીનો વિસ્તાર

ઉપર જણાવેલ યોજનાના મુસદ્દાની એક નકલ જમીન માલિકો તેમજ હિતસંબંધ ધરાવનાર વ્યક્તિઓ તથા જાહેર જનતાને જોવા માટે ટાઉન પ્લાનરની કચેરી, ટાઉન પ્લાનીંગ વિભાગ, સુરત મહાનગરપાલિકા, બહુમાળી બિલ્ડીંગની પાછળ, નાનપુરા, સુરતની કચેરીમાં રજાના દિવસો સિવાય ઓફિસ સમય દરમિયાન ખુલ્લી રાખવામાં આવેલ છે.

સરકારી રાજ્યપત્રમાં ઉપરોક્ત અધિસૂચનની પ્રસિધ્ધ થયાની તારીખથી એક મહીનાની અંદર આ યોજનાથી અસર પામતી કોઈપણ વ્યક્તિ આ યોજનાના સંબંધમાં વાંધા/સૂચનો બે નકલોમાં લેખિતમાં કમિશ્નરશ્રી, સુરત મહાનગરપાલિકાને સુપ્રત કરશે તો, કમિશ્નરશ્રી, સુરત મહાનગરપાલિકા આવા વાંધાઓ યોગ્ય જણાયે ધ્યાને લેશે.

સુરત.

તા. ૦૯-૧૦-૨૦૨૩

સહી/- અવાચ્ય

કમિશ્નર

સુરત મહાનગરપાલિકા

